

પ્રતિ,

- (૧) પ્રાચાર્યશ્રી,
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન - તમામ,
- (૨) આચાર્યશ્રી,
સરકારી/ગ્રાન્ટેડ/નોન ગ્રાન્ટેડ અધ્યાપન મંદિર - તમામ

વિષય:- ડી.એલ.એડ.૧ (ન્યુ કોર્ષ) ની એપ્રિલ-૨૦૧૬ માં લેવાયેલ વાર્ષિક લેખીત પરીક્ષામાં નાપાસ થયેલા કે ગેરહાજર રહેલા ઉમેદવારોને પરીક્ષાની એક વધુ તક આપવા પૂરક પરીક્ષા બાબત.

સંદર્ભ:- પરીક્ષા સમિતિની તા:૨૪/૦૬/૨૦૧૬ ની બેઠક ની કાયવાહી નોંધ.


જય ભારત સાથે જણાવવાનું કે, ગત એપ્રિલ-૨૦૧૬ માં રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા ડી.એલ.એડ. ની પરીક્ષા લેવામાં આવી હતી. એન.સી.ટી.ઇ. નવી દિલ્હી દ્વારા તા.૨૮/૧૧/૨૦૧૪ નાં નોટીફિકેશનથી ડી.એલ.એડ. અભ્યાસક્રમનાં નોર્મ્સ અને સ્ટાન્ડર્ડ્સ નક્કી કરવામાં આવેલ છે. જે અનુસાર આ અભ્યાસક્રમ બે વર્ષનો નિયત થયેલ છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને ત્રણ વર્ષમાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાની છૂટ આપવામાં આવેલ છે.

ગુજરાત રાજ્યમાં જૂન-૨૦૧૫ થી આ નવો અભ્યાસક્રમ અમલમાં આવેલ છે. જેથી જૂન/જુલાઈ-૨૦૧૫ માં આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનાર ઉમેદવારોને એન.સી.ટી.ઇ. ની જોગવાઈઓને અને ધોરણો લાગુ પડે જેથી ગત વાર્ષિક પરીક્ષામાં ડી.એલ.એડ.-૧ (ન્યુ કોર્ષ) માં જે ઉમેદવારો નાપાસ થયેલા કે ગેરહાજરીને કારણે નાપાસ થયેલા છે તેવા ઉમેદવારો ત્રણ વર્ષમાં આ અભ્યાસક્રમ પૂર્ણ કરી શકે તે માટે જરૂરી નિર્ણય કરવા અંગે તા.૨૪/૦૬/૨૦૧૬ નાં રોજ પરીક્ષા સમિતિની એક ખાસ બેઠક બોલાવવામાં આવેલ.

પરીક્ષા સમિતિની આ બેઠકમાં આ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવેલ અને સમિતિએ ડી.એલ.એડ.-૧ (ન્યુ કોર્ષ) નાં એપ્રિલ-૨૦૧૬ નાં લેખીત વાર્ષિક પરીક્ષામાં નોંધાયેલા ઉમેદવારો પૈકી લેખીત કસોટીમાં નાપાસ થયેલા કે ગેરહાજર રહેલા ઉમેદવારોની પૂરક પરીક્ષા લેવા નિર્ણય કરેલ છે. જે અનુસાર નીચે મુજબની કાર્યવાહી કરવા જણાવવામાં આવે છે.

- (૧) આ સાથે સામેલ રાખેલ "પૂરક પરીક્ષા અંગેની અગત્યની સૂચનાઓ" ધ્યાને લઈ તે અનુસાર કાર્યવાહી કરવાની રહેશે. આ સૂચનાઓ કોલેજના નોટીસ બોર્ડ પર મૂકવાની રહેશે.
- (૨) ગત વર્ષ એપ્રિલ-૨૦૧૬ માં લેવાયેલ ડી.એલ.એડ.-૧ (ન્યુ કોર્ષ) ની લેખીત વાર્ષિક પરીક્ષામાં નોંધાયેલા અને તે પૈકીના કોઈ વિષય/વિષયો (કોર્ષ) માં નાપાસ થયેલા કે ગેરહાજર રહેલા ઉમેદવારો જ તે વિષય/વિષયો (કોર્ષ) ની પૂરક પરીક્ષા આપી શકશે. જે વિષય/વિષયો (કોર્ષ) માં પાસ થયેલ છે તેની પૂરક પરીક્ષા આપી શકશે નહિં.
- (૩) ડી.એલ.એડ.-૧ (ન્યુ કોર્ષ) નું પરીણામ રાજ્ય પરીક્ષા બોર્ડની વેબસાઇટ (www.sebexam.org) પર મુકવામાં આવેલ છે. જેમાંથી આપની કોલેજનો ડેટા ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢીને તે અનુસાર જે પરીક્ષાર્થી કોઈ વિષય/વિષયો (કોર્ષ) માં નાપાસ કે ગેરહાજર (વાર્ષિક લેખીત પરીક્ષા) માં હોય તે ઉમેદવારોને આ પૂરક પરીક્ષાની જાણ કરવાની રહેશે.

- (૪) આવા ઉમેદવારોના નિયત નમૂનામાં આવેદનપત્રો કોલેજ ખાતે તા.૦૧/૦૭/૨૦૧૬ થી તા.૦૫/૦૭/૨૦૧૬ દરમિયાન સ્વીકારવાના રહેશે.
- (૫) આ આવેદનપત્રોની વિગતોમાં ખાસ કરીને ઉમેદવારનો સીટ નંબર/ફોટો તથા જે વિષયમાં પૂરક પરીક્ષામાં આપવા માટે આવેદપત્ર ભરેલ છે તે યોગ્ય છે કે કેમ તેની ખાસ ચકાસણી કરવાની રહેશે.
- (૬) ઉમેદવારો પાસેથી વિષય ટીઠ રૂ.૧૦૦/- લેખે પરીક્ષા ફી રોકડેથી સ્વીકારવાની રહેશે.
- (૭) ઉમેદવારો પાસેથી એકત્રિત થયેલ કુલ રકમનો એક જ ડ્રાફ્ટ-"સચિવ, રાજ્ય પરીક્ષા બોર્ડ-ગાંધીનગર" નાં નામનો કઢાવીને આ સાથે સામેલ રાખી પત્રક-એ મુજબની વિગત સાથે ફાઇલ સાથે આ કચેરીને તા.૦૭/૦૭/૨૦૧૬ ના રોજ રૂબરૂમાં જમા કરવાની રહેશે.
- (૮) ઉમેદવારોના આવેદનપત્રો ગત વાર્ષિક પરીક્ષાનાં સીટ નંબરના ચડતા ક્રમમાં ગોઠવીને સીરીયલ ક્રમ નંબર આપીને ફાઇલ તૈયાર કરી આ સાથે સામેલ રાખેલ પત્રક-બી મુજબની વિગતે એકસેલ સીટમાં પત્રક તૈયાર કરી આ પત્રની નકલ સાથે આવેદનપત્રોની ફાઇલ તા.૦૭/૦૭/૨૦૧૬ નાં રોજ રૂબરૂમાં જમા કરાવવાની રહેશે.
- (૯) આ એકસેલ સીટમાં અંગ્રેજી આંકડામાં જ વિગતો ભરવાની રહેશે અન્યથા સ્વીકારવામાં આવશે નહીં તથા આ એકસેલ સીટની PDF ફોરમેટ કર્યા વગર માત્ર એકસેલ ફાઇલ જ બનાવવાની રહેશે. અને તે ઇ-મેઇલથી બોર્ડને મોકલી આપવાની રહેશે. આ ઇ-મેઇલ તા.૦૬/૦૭/૨૦૧૬ નાં રોજ અચૂક મોકલી આપવાનો રહેશે.
- (૧૦) જે કોલેજ ઇ-મેઇલથી માહિતી નહિં મોકલી હોય તેની માહિતી સ્વીકારવામાં આવશે નહિં.
- (૧૧) આ પૂરક પરીક્ષાનું સમયપત્રક બોર્ડની વેબસાઇટ પર તા.૧૧/૦૭/૨૦૧૬ નાં રોજ મુકવામાં આવશે.
- (૧૨) આ પૂરક પરીક્ષા તા.૨૯/૦૭/૨૦૧૬ થી શરૂ થશે.
- (૧૩) દરરોજ બે પેપરો મુજબ સમયપત્રક ગોઠવવામાં આવશે.
- (૧૪) આ પરીક્ષામાં ઉપસ્થિત થનાર ઉમેદવારોની હોલ ટીકીટ તા.૨૫/૦૭/૨૦૧૬ નાં રોજ બોર્ડની કચેરી ખાતેથી રૂબરૂ આવીને મેળવી લેવાની રહેશે. આ હોલ ટીકીટમાં ઉમેદવારોના વિષયોની તેમજ તમામ વિગતોની ચકાસણી કરવાની રહેશે અને આ હોલ ટીકીટ ઉમેદવારોને સહિ/સિક્કા કરી ઉમેદવારોને સમયસર પહોંચી કરવાની રહેશે.



(ડી.આર.સરબવા)

સચિવ

રાજ્ય પરીક્ષા બોર્ડ

ગાંધીનગર

નકલ જાણ અર્થે રવાના:-

- (૧) નિયામકશ્રી, જી.સી.ઇ.આર.ટી., ગાંધીનગર
(૨) અધ્યક્ષશ્રી, રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર

નકલ કાર્યવાહી અર્થે રવાના:-

- ડી.એલ.એડ. શાખા (આ કચેરી)